### GOPAL SNACKS LIMITED

(Formerly known as Gopal Snacks Private Limited)

**Regd. Office/Unit 1** - Plot No. G2322-23-24, GIDC, Metoda, Tal. - Lodhika, Dist - Rajkot - 360021, (Gujarat), India. Ph : 02827 297060

CIN: U15400GJ2009PLC058781

email: info@gopalsnacks.com | www.gopalnamkeen.com



Ref: GSL/CS/SE/Q1/2024-25 Date: 04.04.2024

BSE Limited	National Stock Exchange Limited
Department of Corporate Services,	Exchange Plaza, 5 <sup>th</sup> Floor,
Pheroze Jeejeebhoy Towers,	Plot No. C/1, G Block,
Dalal Street, Mumbai – 400001	Bandra-Kurla Complex, Mumbai – 400051
Script code: 544140	Symbol: GOPAL

Sub: Intimation of Newspaper Publication of the Un-Audited Financial Results of the Company for the quarter and nine months ended on December 31, 2023

Dear Sir / Madam,

Pursuant to the requirements of the Regulation 47 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, as amended from time to time, the Un-Audited Financial Results of the Company for the quarter and nine months ended on December 31, 2023 as approved by the Board of Directors at their meeting held on Tuesday, April 02, 2024 is published in "The Economic Times" in English language newspaper and in "Navgujarat Samay" in Regional language (Gujarati) newspaper on today, Thursday, April 04, 2024. The copies of the newspaper publication are enclosed herewith for your reference.

The above-mentioned newspaper publication will also be available on website of the Company at <a href="https://www.gopalnamkeen.com">www.gopalnamkeen.com</a>

Kindly acknowledge and take on your record. Thanking You.

Yours Faithfully, For, GOPAL SNACKS LIMITED

CS Mayur Gangani Company Secretary and Compliance officer Membership No. F9980

Encls: a/a

Unit 2: GS:Survey No. 435/1A, 432, Pawaddauna Road, NH-6, Village-Mouda, Nagpur - 441104, (Maharashtra), India. Unit 3: G5:Survey. No. 267, 271, 272, 274, Village: Rahiyol - 383310, Taluka - Dhansura, District - Aravalli, (Gujarat), India.









### **Motorola Expects Smartphone Sales** Volumes in India to Double in 2024



New Delhi: China's Lenovo-owned Motorola plans to double its volumes from smartphone sales in 2024 on the back of a growing push for premiumisation, targeting a market share of 5% from 3.5% currently two top company executives said. "We have moved into the phase of accelerating our business globally with the target to become the third largest smartphone brand globally in the next 8-12 quarters. Naturally, to do that, we have to be number 3 in India as well," Prashant Mani, executive director-Asia Pacific at Motorola, told ET.

The executive director-Asia Pacific at Motorola, told ET.

The executive director-Asia Pacific at Motorola, told ET.

The executive added that Motorola's business in India has more han doubled in terms of device sell-outs, specifically its premium Edge series models where volumes grew four times. "The Edge series models where volumes grew four times." The Edge series models where volumes grew four times, "The Edge series models where volumes from the part of our premium portfolio, now contributions of the part of our premium portfolio, now contributions of the part of our premium portfolio, now contributions of the part of our premium portfolio, now contributions of the part of our premium portfolio, now contributions of the part of our premium portfolio, now contributions of the part of our premium portfolio, now contributions of the part of the part of our premium portfolio, now contributions of the part of the part of the part of the part of our premium portfolio, now contributions of the part of the part of during the part of our premium portfolio, now contributions of the part of the part of during the part of the part of during the part of the part of the part of the part of during the part of the pa that out of the 35,000 retail stores it is present in, there are 3,000-5,000 stores where consumers step in to buy premium products.

## Bharti Joins Issue with Jio over Satcom FWA Service

Counters Jio's contention that administratively given waves can't be used for commercial FWA

Kalyan.Parbat@timesgroup.com

Kalyan.Parbat@timesgroup.com
Kolkata: Reliance Jio, India's telecom market leader, and the
Bharti Group are oncourse for afcree battle over using spectrum allocated administratively or with
a uctions, for stellite-based fixed wireless access (FWA) services.
Bharti-backed Eutelsat Onewho has rejected billionaire Mukesh
Ambani-owned Jio's concention
that administratively allocated satellite spectrum can't be used for
offering commercial FWA services merely since it is a 5G use case.
Eutelsat also feels 5G-based FWA
and satellite-based FWA are distinct services with different busimess models and there is no justification in Jio pushing the government to ensure only satellite-based FWA services are offered
through auctioned spectrum.
"Jio is unnecessarily trying to
confuse matters. We comparine

sed FWA services are offered through auctioned spectrum.

"Jio is unnecessarily trying to confuse matters by comparing apples with oranges. It's a clear fact that 5G-based FWA services will be directly offered by telcos to millions or retail users across India whereas satellite-based services willonly be offered in the country's remote, unconnected regions, primarily to enterprises, defence forces, government health centres and for disaster management operations via a B2B model," a senior Eutlesta One-Web executive said.

Eutelsat One-Web, in fact, asserts

that it is not in competition with Jio as it will not be directly offe-ring satellite-based FWA services

ring satellite-based FWA services to retail users. To be sure, Bharti Group-backed telecom operator Bharti Airtel, along with Jio, have started offering 5G FWA services to retail users in the country mainly in areas where laying fibre is a chal-

as where laying fibre is a cnarlenge.

Top executives of Eutelsat Onewhere countered Jio after the latter recently urged the Department of 
Telecommunications (DoT) not to 
allow use of satellite spectrum allocated administratively for 
looking to 
poul ahead of Elon grounds of it bemig a 50 use case, 
arguing that such 
satellite-based

Musk's ing a 5G use case, straink Ai, a stellite-based FWA services must only be offered through auctioned airwaves. Further, Jio said in case the go-vernment decides to allow FWA for satellite players, then the amo-units paid by teloos for buying such spectrum in past auctions must be refunded to ensure a le-vel-playing field. "Given that GS-based FWA is a B2C broadband service offered to retail customers and that the satel-

B2C broadband service offered to retail customers and that the satel-lite-based service will predomi-nantly be meant for a much smaller

**Big Stakes** 

Bharti Airtel, along with Jio, is offering 5C FWA services to retail users in India, mainly in areas where laying fibre is a challenge

OneWeb asserts that it is not in competition with Jio services to retail users

Jio says if govt decides to allow FWA for satellite players, amounts paid by telcos for buying such spectrum in past auctions must be refunded

customer base, mostly in the B2B domain in remote areas that are unconnected, the logic of refund as called out in the submission by Jio doesn't hold good," said the Eutelsat OneWeb executive cited earlier. The stakes are huge for both companies.

administrative route at a nominal application fee. But Jio, which like Eutelsat One-Web, also has a GMPCS (global mobile personal communications by satellite services) permit, is in no mood to give the sateom company an easy ride in India's still nascent broadband-from-space market with high growth potential. This, even as the government readies the finalise modalities around administrative allocation of commercial satellite spectrum and deterministrative allocation of commercial satellites pectrum and deterministrative allocation of commercial satellites spectrum and deterministrative allocations of commercial satellites around administrative allocations of commercial satellites spectrum and deterministrative allocations of commercial satellites around administrative allocations of commercial satellites are commerc companies.

Eutelsat OneWeb, which recently received demo or 'trial' satellite spectrum via the administrative route from DoT, is looking to pull ahead of Elon Musk's Stafflink and Jio in an increasingly competitive space to become the first global satellite operator to offer broad-band-from space services in India. Eutelsat's aim is to roll out satellite broadband in India's rural and remote regions underserved by terrestrial networks. The company has been allocated decempany has been allocated decempany.

FOR FULL REPORT, GO TO

### Vi Investors Clear ₹20kcr Fundraising Plan Funding via equity & equity-linked instruments, equity part could be over by June end

New Delhi: Shareholders of tel-com company Vodafone Idea (V com company Vodafone Idea (Vi) have cleared a proposal to raise ₹20,000 crore through equity and equity-linked instruments, a mo-

equity-linked instruments, a move that would give a much needle lifeline to the cash-strapped telco. VI's shares closed 0.82% higher at 13.55 apice on BSE after jumping 4% intraday on Wednesday. With shareholders' approval in place, the loss-making carrier expects to complete the equity fund raise by the end of June. Promoters of the company will also participate in this round, as previously announced.



tor analysts said.

"Assuming that the promoters in-fuse ₹2,000 crore, as previously an-nounced the rest may come from a public rights issue or an FPO. We do not believe that either the go-

Besides promoter infusion of ₹2,000 cr, upcoming round could see a public rights issue or a follow-on public offer

tor will come on board," an analyst at a Mumbai-brokerrage said. In a report, brokerage CLSA said it has observed keen interest from foreign institutional investors in the UK on Vis equity-raise plan. "In the near term, Vis spending on 5G roll out in major cities will help it to arrest the subscriber

churn. However, these investments are still way behind of ₹50,000 crore done by Airtel already," the person quoted above added.

quoted above added.
On February 27, Vi announced that its board of directors had approved the equity financing plan.
These could be through conver-

These could be through convertible debentures, warrants, or other securities convertible into equity shares, global depository receipts, American depository receipts or foreign currency convertible bonds. The company held vertible bonds. The company held an extraordinary general meeting (EGM) on Tuesday to approve the same through audio-visual medi-um where shareholders were invi-ted to participate in passing the re-solutions of the company.

ALIENS DEVELOPERS' PROJECTS TO GIVE HOUSING TO 2,000

### Swamih, Nisus Fin Infuse ₹465 cr into **Hyderabad Projects**

Kailash.Babar Etimesgroup.com

Mumbai: The Special Window for Completion of Construction of Af-fordable and Mid-Income Housing Projects (SWAMIH) and realty cre-dit flund Nisus Finance have toget-her invested a total over ₹465 crore across two Hyderabad projects of Aliens Developers. SWAMIH, the state-backed and SBICAP Ventures-managed last-mile financieur nateform exceed to

SBICAP Ventures-managed last-mile financing platform created to give traction to stalled housing. Allens Space Station is a megamid-income housing project. The other development is Allens HUB, a lar-ge scale plotted development pro-ject.

both the projects and the SWAMIH Fund has invested ₹320 crore in the mid-income housing project with over 2,000 homebuyers. "Nisus and SWAMIH have earlier

"Nisus and SWA MIH have earlier partnered on two other mutual investment opportunities. Our investment in the mid-income housing project will help provide delivery to over 2,000 homebuyers. This investment is centric to our strategy in the fund to generate significant returns through a strongly risk mitigated structure with high asset and cash flow cover." Amit Goenka, MD&CEO, Nisus Finance.

nance
Nisus has invested the amount
through its Real Estate Special Opportunities Fund-I (RESO-I), managed by Nisus BCD Advisors LLP.
This investment is being utilised to
take over the loans of the erstwhile
lender Edelweiss and the balance
for project expenses.
The Nisus BCD Fund will hold a
senior secured and exclusive pri-

The Nisus BCD Fund will hold a senior secured and exclusive primary security on the plotted development project on the developer's ownedland spread across 272 acres in Chennaramio cality. The project is a township with a golf course and other modern amenities for a plotted golf course living.

The township has a total 2.400 plots with an average area of 2.700 plots with an average area of 2.700.

The township has a total 2,700 plots with an average area of 2,700 sq ft with an estimated topline of over 1,200 crore.

over ₹1,200 crore.

In the mid-income housing project, SWAMHI Fund has subscribed to rated debentures of ₹320 crobed to rated debentures of ₹320 cro-re issued by Aliens Developers and listed on the Bombay Stock ExThe Ventures So Far

₹145 cr projects



Both SWAMIH Fund and Nisus investment in this project will be utilised for the completion of the

project. Nisus Finance has cash flow sha Nisus Finance has cashflow sharing in this second project spread over 15 acres with saleable area potential of 3.4 million sq ft across 13 high-rise towers in Hyderabad's Tellapur locality. The project is nearly 70% complete and has achieved 75% sales so far. The project for which Nisus has partnered with SWAMIH Fund for investment, has a total revenue potential of 42,200 crore. ET's email query to SWAMIH Fund remained unanswered until the publication of this report.

til the publication of this report.

PROJECT COMPLETION
This investment by Nisus and SWAMIH will help in ensuring the project will be completed and delayered tower wise and fully exited in 812 quarters Nisus Finance is focused on identifying highly value accretive opportunities within real estate projects, offering enhanced yields and robust asset cover to unlock substantial value through structured capital. It makes opportunistic medium-term structured investments in mid-income, affordable housing, and plottetdevelopment projects.

## Panache Swift money Pop star Taylor Swift has become the first musician to join the so solely on the basis of music

### Cannes yacht encounter sparked 1MDB fraud In 2009, three of the main accused met off the coast at

Cannes, which set the ball rolling for a \$4.5-billion scam

t began with a meeting on a yacht off the coast of Cannes in the summer of 2009. The newly-elected prime minister of Malaysia was abourd at the

in Malaysia was aboard at the invitation of businessman Jho Low and Saudi-Swiss businessman Tarek Obaid. Themen hadgathered to explore deals for Malaysia's new economic development fund, IMDB.

Today, the prime minister Najib Razak is in prison serving time for corruption, though he's seeking to serve time under house arrest. Low, the alleged mastermind behind the \$4.5 billion defrauding of IMDB, remains at large. And Obaid and his business partner Patrick Mahony standtrial at Switzerland's top criminal court, accused of creating a sham oil exploration company through which

court, accused of creating a sham oil exploration company through which they stole more than \$1.8 billion. Neither Mahony nor Obaid have spoken in public about their deals with Jho Low. The month-long trial, set in Switzerland because the two men based their business there, may reveal fresh details about the fugitive, who is suspected of pulling off arguably the biggest financial heist of the century.

biggest financial heist of the century. In the indictment, Swiss prosecutors lay out the pair's alleged scheme



which, they say, included negotiating on behalf of a Saudi king they had no mandate from, while claiming the rights to a Caspian Sea oilfield that they never controlled—from that first Mediterranean meeting in 2009.

### Saudi connections?

baid founded oil exploration ompany Petrosaudi in 2005 with company Petrosaudi in 2005 with his acquaintance Prince Turki Bin Abdullah al Saud, determined to capitalise on the connections that a royalname could enable. He also secured a loan through Mahony, aformer classmate, who would become Petrosaudi's unofficial chief investment officer in 2009. Prosecutors highlighted emails

Prosecutors highlighted emails

Following the Cannes meeting, proposed that 1MDB and Petro proposed that 1MDB and Petrosaudi create a joint venture to exploit Petrosaudi's stake in a Turkmeni oilfield. Obaid laid out in writing, according to prosecutors, that Petrosaudi would bring "\$2 billion worth of its assets in the energy sector into the joint-venture company". There was one problem: Petrosaudi didn't own the oilfield or the rights to it. So Obaid turned to anoil consultant and old family friend to value the oilfield.

old family friend to value the oilfield. Nine days later, he produced a report that put the "fair net present value" of the assets at between \$2.98 billion and \$4.06 billion

the assets at between \$2.98 billion and \$4.06 billion. Between 2009 and 2011, the men allegedly took a total of \$1.85 billion from 1MDB, with Obaid personally pocketing \$580 million, and Mahony, \$37 million

### 

Ajax suspends CEO over insider trading suspicions Dutch football club Ajax has suspended its CEO and chairman

suspended its CEO and chairman Alex Kroes on suspicion of insider trading, pilingmore woe on what's already been a horror season.

The club said it learnt about Kroes buying more than 17,000 Ajax shares a week before his appointment was announced on August 2, 2023. "The Supervisory Board sought was the property of th

external legal advice, which indicates that he likely engaged in

Kroes said it was "not the wisest decision", but said he had intended to send a "positive signal to radiate confidence in the club". This is the latest setback in a season where Ajax endured its worst ever start to a top-flight season. With less than 10 matches togo, the club is a humiliating 28 are into height deach vital BSV. points behind arch-rivals. Eindhoven and may not even qualify for European football next season. — AFP

PIC: GETTY IMAGES

### \$90 million



### GOPAL SNACKS LIMITED

stered Office: Plot No. G2322, G2323 & G2324, GIDC, Metoda, Tal.: Lodhika, Dist.: Rajkot. Gujarat. India. | Tel No.: +912827297060 | E-mail: cs@gopalsnacks.cor Web: www.gopalnamkeen.com | CIN: U15400GJ2009PLC058781



Sr. No.	Particular	Quarter Ended		d	Nine Months Ended		Year Ended
		31 Dec. 2023 Unaudited	30 Sep. 2023 Unaudited	31 Dec. 2022 Unaudited	31 Dec. 2023 Unaudited	31 Dec. 2022 Unaudited	31 March 2023 Audited
02	Net Profit / (Loss) for the period (Before Tax, Exceptional and/or Extra-ordinary items)	265.48	362.19	477.14	1015.28	1187.53	1518.48
03	Net Profit / (Loss) for The Period Before Tax (after exceptional and/ or extra-ordinary items)	265.48	362.19	477.14	1015.28	1187.53	1518.48
04	Net Profit / (Loss) for The Period After Tax (after exceptional and/ or extra-ordinary items)	178.92	272.07	330.95	734.58	851.29	1123.69
05	Total Comprehensive income for the period [comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	178.37	270.77	321.06	730.56	847.03	1132.18
06	Paid up equity share capital (face value of ₹1/- per share)	124.60	124.60	124.60	124.60	124.60	124.60
07	Other equity (excluding revaluation reserve)						2,784.18
08	Earning per share (of ₹ 1/- each) (not annualized)		11		9		
	A. Basic (Rs.)	1.44	2.18	2.66	5.90	6.83	9.02
	B. Diluted (Rs.)	1.44	2.18	2.66	5.90	6.83	9.02

Notes:
1. The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Other Disclosures Requirements) Regulations, 2015. The dirromat of the Unaudited Standslone Financial Results is available on the stock exchange website (www.bseindia.com and www.nseindia.com) and

Company's website (www.gppainamkeen.com)
Company's website (www.gppainamkeen.com)
2. The aforesaid Unaudited Financial Results for the quarter and nine months were reviewed by the Audit Committee and approved by the Board of Pinancial Results for the quarter and nine months were reviewed by the Audit Committee and approved by the Board of Pinancial Results for the company at their meeting held on April 02, 2024. For, GOPAL SNACKS LIMITED Sd/-

Place: Rajkot Date: April 02, 2024



રતલામ ડિવિઝનના બિલડી-મેઘનગર વચ્ચેની ઘટનાઃ બંને મુસાફરોની અટક , વેન્ડરને સારવાર અર્થે ખસેડાયો

# ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં બે મુસાફરોની દાદાગીરી, પેન્ટ્રી કારના વેન્ડરને ટ્રેનમાંથી બહાર ફેંકી દીધો

» ટ્રેનમાં ખાણીંપીણીના સામાન વેચવા માટે અવરજવર મામલે બબાલ થઈ હતી

**નવગુજરાત સમય >** દાહોદ

પશ્ચિમ રેલવેના રતલામ ડિવિઝનના બિલડી નજીક પેન્ટ્રી કારમાં વેન્ડર તરીકે કામ કરતા કર્મચારીને ટ્રેનમાં મુસાફરી કરી રહેલા બે મુસાફરોએ માં બેનની ગાળ બોલી. મારામારી કરી ચાલુ ગાડીમાંથી ફેંકી દેતા ચકચાર પછી જવા પામી છે. જોકે ટ્રેન ધીમી ગતિએ ચાલતી હોવાથી વેન્ડરનો બચાવ થયો હતો.પરંતુ તેને શરીરે ઈજાઓ પહોંચતા બેભાન અવસ્થામાં 108 મારફતે મેઘનગરના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જ્યારે બંને મુસાફરોને



તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અમૃતસરથી બાંદ્રા તરફ જતી 12904 અમૃતસર-બાંદ્રા ગોલ્ડન ટેમ્પલ મેલમાં S 6 માં સવાર દ્વારા કોઈ પ્રતિક્રિયા ન આપી આગળ મુસાફરો સવારથી જ પેન્ટ્રી કારમાં વેન્ડર તરીકે કામ કકરતો કર્મચારી S/6 સાથે જોડેલો જનરલ કોચમાં ખાણીપીણીનું આરપીએક દ્વારા ઝડપી પાડી આગળની સામાન વેચવા અવરજવર કરી રહ્યો



હતો. આ દરમિયાન ટ્રેનમાં રહેલા બંને મુસાફરો વેન્ડર જોડે માથાકૂટ કરી પરેશાન કરી રહ્યા હતા.પરંતુ કર્મચારી જતો રહ્યો હતો.પરંતુ રસ્તામાં આ ટ્રેન બિલડી - મેઘનગર વચ્ચેથી ધીમી ગતિએ પસાર થઈ રહી હતી.તે સમયે ઉપરોક્ત બંને મુસાફરોએ પુનઃ એક વખત આ

વેન્ડર જોડે માથાકૂટ કરતા પરિસ્થિતિ વણસી હતી. બન્ને મુસાફરોએ રીતસર વેન્ડર જોડે મારઝુંડ કરી માં બેન સમાની ગાળો આપી હતી.અને આ વેન્ડરને ચાલુ ગાડીએ ફેકી દેતા આસપાસના મુસાફરોએ બુમાબુમ કરી ચેન પુલિંગ કરી આ ટ્રેનને ઉભી રાખી દીધી હતી.જોકે આ ઘટના બની તે સમયે આ સુપરફાસ્ટ

વેન્ડરનો જીવ બચી ગયો હતોએમપરંતુ વેન્ડરને શરીરના ભાગે ઈજાઓ થતા તે બેભાન થવા પામ્યો હતો.આ મામલામાં પેન્ટ્રી કારના મેનેજર દ્વારા મેઘનગર આરપીએફને જાણ કરી હતી.જે બાદ મેઘનગરના ઇન્ચાર્જ IPF લીનીશા બેરાગી દ્વારા આરપીએફને ઘટના સ્થળે રવાના કરી હતી. આ દરમિયાન ઇજાગ્રસ્ત વેન્ડરને 108 મારફતે પહેલા મેઘનગરના જીવન જ્યોતિ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.ત્યારબાદ વધું સારવાર અર્થે નજીકના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. જોકે વેન્ડર જોડે માથાકુટ કરનાર ઉપરોક્ત બંને મુસાફરોને આરપીએફ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે આરપીએક તેમજ જીઆરપી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં

# રૂપાલાના વિવાદને પગલે સુરતમાં ધૂંઆપૂંઆ કલેક્ટર કચેરીએ ક્ષત્રિય સમાજનો મોરચો

» ટિકિટ રદ્દ નહીં તો ભાજપ વિરૂદ્ધ મતદાનની ચીમકી

**નવગુજરાત સમય >** સુરત

આગામી લોકસભાની ચંટણી પર્વે રાજકોટ બેઠક પર ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમરૂપાલાવિરૂદ્ધરાજપુતસમાજનો વિરોધ હવે સુરત સુધી પહોંચી ચુક્યો છે. બુધવારે સુરતમાં અલગ - અલગ ક્ષત્રિય સમાજો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. પુરૂષોત્તમ રૂપાલા દ્વારા સમાજની લાગણી દુભાવી હોવાનો આરોપ મૂકી તેમની ઉમેદવારી રદ્દ કરવાની માંગ કરી છે. જો તેમને નહીં બદલાય તો ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજકોટ બેઠક પરથી લોકસભા બેઠકના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાની ટિપ્પણીને પગલે રાજપુત સમાજમાં ભારેલો અગ્નિ ઠરવાનું નામ લેતો નથી. ટિપ્પણી અંગે જાહેરમાં માફી માંગવા છતાં રાજપુત સમાજ તેમને માફી આપવાના મુડમાં હોય તેમ જણાઈ રહ્યું નથી. રાજ્યભરમાં ઠેર ઠેર અલગ



ગામોમાં પણ રાજપત સમાજ દ્વારા પુરૂષોત્તમ રૂપાલા વિરૂદ્ધ પોસ્ટર વોર શરૂ થઈ ચુક્યું છે ત્યારે આજે સુરતમાં વસતાં કચ્છ-કાઠિયાવાડ અને સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાંથી આવીને વસેલા રાજપત સમાજની મહિલાઓ અને પુરૂષ આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને તેમની ઉમેદવાર રદ્દ કરવા અંગેની રજૂઆત કરી હતી.

જિલ્લા કલેકટર કચેરીએ પહોંચેલા રાજપુત સમાજના આગેવાનો અને મહિલાઓએ એકસૂરમાં પુરૂષોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, રૂપાલાએ કાર્યક્રમ દરમિયાન રાજા-રજવાડા વિશે કોમી લાગણી દભાવવાનો પ્રયાસ કર્યો હતો. બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાય તેવી ભાષાનો ઉપયોગ કરી રાજ્યમાં શાંતિ ડહોળવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો

### મહિલાઓ વડાપ્રધાનને 1 લાખ પોસ્ટકાર્ડ લખશે

કલેક્ટર કરોરીએ આવેદનપત્ર આપવા સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. રાજપત સમાજની મહિલાએ કહ્યં हतुं हैं, अभे asıyधानने 1,00,000 પોસ્ટકાર્ડ લખીશું, પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમે મોદીને એક જ વાત કહેવા માગીએ છીએ કે, રૂપાલા જેવા લોકોની ટીકિટ કાપવી જોઈએ. રૂપાલાને ટીક્ટિટ ચથાવત રખાશે તો અમે ભાજપના વિરોધમાં મતદાન કરતાં અચકાઈશું નહી.

હોવાનો તેમના વિરૂદ્ધ આક્ષેપ કરવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીને વફાદાર રહેલો ક્ષત્રિય સમાજ બહેન અને દિકરીઓ માટે કરવામાં આવેલી ટિપ્પણીથી ક્રોધે ભરાયેલો છે. જ્યાં સુધી પુરૂષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ નહીં કરવામાં આવે ત્યાં સુધી વિરોધ યથાવત્ રહેશે તેવી ચિમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી હતી. જો રૂપાલાની ઉમેદવારી રદ્દ નહીં કરવામાં આવે તો સમગ્ર દેશમાં ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરૂદ્ધ મતદાન કરવામાં આવશે, તેવી ચીમકી પણ આપવામાં આવી હતી.

## ઉમરેઠમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેનર લગાવી વિરોધ વ્યક્ત કરાયો

**નવગુજરાત સમય >** આણંદ

**ા**કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે કરેલા ઉચ્ચારણોના આણંદ જિલ્લામાં પણ તેના પડઘા પડ્યા છે. વ્યાપી જવા પામ્યો છે. બીજી તરફ જિલ્લાના વિવિધ ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા કલેક્ટરને આવેદન આપી પરસોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ તેમના સાંસદ વિરુદ્ધના જુના ઉચ્ચારણ કરવાની માંગણી કરવામાં આવી છે.

ઉમરેઠમાં પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં બેનરો લગાવી આક્રોશ વ્યક્ત ઉપર માત્ર એક જ સમાજ બિરાજમાન કરવામાં આવ્યો છે. ઉમરેઠ રાજપુત સમાજના નામે લગાવેલા બેનરમાં 'આ વ્યક્તિની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો સમગ્ર ગુજરાતમાં ભાજપનો વિરોધ કરવામાં આવશે' તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

ઉમરેઠના રાજપુત સંગઠનના યુવકોએ બેનર સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. જેને કારણે રાજકારણમાં ભારે ગરમાવો

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમાર પણ ક્ષત્રિય સમાજમાંથી આવતા હોવાને કારણે અંગેની વીડિયો ક્લિપ પણ ફરતી થઈ છે. વળી સોશિયલ મીડિયામાં પણ તમામ પદ હોવાના મેસેજ પણ ચાલી રહ્યા છે જેના કારણે આ વખતની લોકસભાની ચુંટણીમાં

ભારે રસાકસી સર્જાય તેવા એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. આશંદ જિલ્લાના ક્ષત્રિય – રાજપૂત સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલા નો વિરોધ વેગ પકડી રહ્યો હોવાથી આણંદ લોકસભા બેઠક પર પણ તેની અસર થાય તો નવાઈ નહીં તેવી ચર્ચાઓ પણ થઈ

# સુરતમાં એક વર્ષમાં 2848 કરોડનાં શાકભાજીનું વેચાણ

» 320 કરોડના બટાકા, 286 કરોડની ડુંગળી, 209 કરોડનું લસણ, 283 કરોડના ટામેટા, 101 કરોડનું ફ્લાવર, 107 કરોડના ભીંડાનું વેચાણ

**નવગુજરાત સમચ >** સુરત

ટર્નઓવર ૨૮૪૮ કરોડને આંબી ટર્નઓવર અંદાજિત ૮૦૦ કરોડ ૩૨૦ કરોડના બટાટા, ૨૮૬ કરોડના ૨૦૦૦ કરોડ હતું. જે આ વર્ષે વધીને

કાંદા, ૨૦૯ કરોડનું લસણ, ૨૮૩ કરોડના ટાંમેટા અને ૧૦૮ કરોડના ભીંડાનું વેચાશ થયું હતું. આ સાથે જ તુવેર, પાપડી, કોબેજ સહિતના અન્ય શાકભાજીના વેચાણ સાથે ૨૮૪૮ કરોડનું ટર્નઓવર થયું હતું.

આ અંગે માહિતી આપતા સુરત

APMCના પ્રમુખ સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, સુરત એપીએમસીનું ટર્નઓવર કૂદકેને ભૂસકે વધી રહ્યું **■દ**ક્ષિણ ગુજરાતની સૌથી વિશાળ છે. અહીંયા સુરતના વિવિધ તાલુકા અને સમુદ્ર સુરત સરદાર માર્કેટનું ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓની સાથે સાથે દિલ્હી, હિમાચલ પ્રદેશ, ગયું છે. બીજા શબ્દોમાં કહીએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર સુરતીઓ એક વર્ષમાં ૨૮૪૮ કરોડના સહિતના ૧૦ રાજ્યોમાંથી રોજિંદા લીલા શાકભાજી, કાંદા, બટાટા, મરચાં હજારો ટન શાકભાજી ઠલવાઈ છે. અને આદું ઝાપટી ગયા છે. ગતવર્ષની તેમજ સુરત એપીએમસી સુરત શહેર તુલનાએ સુરત એપીએમસીનું અને જિલ્લાની ૧ કરોડની વસ્તીને રોજિંદા લાલી શાકભાજી, કાંદા, વધ્યું હતું. નાણાકિય વર્ષ ૨૦૨૩- બટાટા, મરચાં સહિતી વસ્તુઓ પૂરી ૨૪માં સુરતી એપીએમસી માર્કેટમાંથી પાડે છે. હવે ગતવર્ષે માર્કેટનું ટર્નઓવર

### 134 કરોડના લીલા વટાણા ઉપડી ગયા

સુરતમાં વિક્એન્ડ, વાર-તહેવાર, બર્થ-ડે, એનવર્સિરી જેવાં અવસર પર લોકો હોટેલ અથવા બહાર જમવાનું વધુ પસંદ કરે છે. ઢોંસાથી માંડીને પાંઉભાજીની દુકાનો શહેરના તમામે તમામ વિસ્તારમાં જોવા મળે છે. સુરતમાં પાંઉભાજીનું ખાનારો મોટો વર્ગ છે. ત્યારે પાંઉભાજીના ચલણને પગલે સુરત એપીએમસીમાંથી એક વર્ષમાં અદ્યદ્ય ૧૩૪ કરોડ રૂપિયા લીલા વટાણા ઉપડી

### મેંગો પલ્પનું અમેરિકા સહિતના 7 દેશમાં વેચાણ

સુરત એપીએમસીમાં કેરીનું ટર્નઓવર ૧૯૯ કરોડનું છે. હવે સુરત એપીએમસી ખુદ કેરીમાંથી મેંગો પત્પ પણ બનાવે છે. આ મેંગો પત્પ અમેરિકા, કોરિયા, દુબઈ, રશિયા, જર્મની સહિતના સાત દેશોમાં નિકાસ કરવામાં આવે છે. આ ઉપરાંત સ્થાનિક લેવલે પણ મોટાપાચે મેંગો પત્પનું વેચાણ થાચ છે. સ્વાદપ્રિય સુરતીઓ આખું વર્ષ કેરીના રસનો આનંદ માણી શકે તે માટે મેંગો પત્પને પ્રોસેસ કરીને સાચવવામાં આવે છે.

ટર્નઓવર વધી ગયું છે. ખેડૂતો અને પહેલી એલિવેટેડ માર્કેટ એપીએમસીમાં ઉત્પાદન કરવામાં આવે છે.

૨૮૪૮ કરોડ કરોડ પર પહોંચી ગયું બનાવવાનો આરંભ કરી દેવાયો છે. છે. એટલે કે એક વર્ષમાં ૮૦૦ કરોડનું આગામી ૨૫ વર્ષની વસ્તીને ધ્યાને લઈ આ આયોજન કરાયું છે. આ ઉપરાંત વેપારીઓને હજુ સારુ વાતાવરણ સુરત એપીએમસી રાજ્યની પહેલી અને જગ્યા મળી રહે તેથી રાજ્યની માર્કેટ છે જ્યાં વેસ્ટમાંથી સીએનજીનું

# નર્મદાના ગોપાલપુરમાં ભાજપ કાર્યકરો માટે પ્રવેશબંધી કરાઈ

» ક્ષત્રિય સમાજ દ્વારા **૩પાલાનો વિરોધ કરાયો** 

**નવગુજરાત સમય >** રાજપીપળા

**ા**રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટીકીટ રદ કરવા એક તરફ રાજપુત સમાજ અડગ છે તો બીજી બાજુ ભાજપ પણ રૂપાલાની ખાતે રાજપુત સમાજ અને ભાજપ વચ્ચેની બેઠક પણ નિષ્ફળ નીવડી છે ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામનાં રાજપુતો પણ રૂપાલાની વિરુદ્ધ આવી ગયા છે.એમણે ગામની બહાર બેનર લગાવ્યું છે કે જ્યાં સુધી રૂપાલાની ટિકીટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના નેતાઓ કે કાર્યકરોએ ગોપાલપુરામાં પ્રવેશ કરવો નહીં.સાથે એવી ચીમકી પણ આપી છે કે જો રૂપાલાની ટીકીટ રદ નહીં થાય તો અમે ભાજપને બતાવી દઈશું કે રાજપુત નાંદોદ તાલુકાના ગોપલપુરા ગામનાં

રાજપુતસમાજના આગેવાનોએ પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું.અને ગામના આગેવાનોએ એક સુરે એમ જણાવ્યું હતું કે રૂપાલાને માફી નહિ. એમની ટીકીટ રદ કરો એ જ અમારી માંગ છે.એમણે રૂપાલા સામે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા સમાજ વિશે ગમે તેમ બોલી ટીકીટ કાપવાના મુડમાં નથી.અમદાવાદ જાય અને પછી માફી માંગી લેવાની એવું ના ચલાવી લેવાય.રાજપુત સમાજ પોતાનું માથું કપાવી નાખીને પાઘડી બાંધવા વાળો સમાજ છે.રૂપાલા મુળ શિક્ષક છે એમને રાજપતોના ઈતિહાસની તો ખબર જ હશે. પણ એમણે અમારા સમાજને નીચો પાડવા માટે જ જાણી જોઈને અછકલાપણું બતાવ્યું છે, એ માફીને લાયક છે જ નહિ. જો રૂપાલાની ટીકીટ રદ નહિ થાય તો અમે ગામે ગામ રૂપાલા વિરુદ્ધ આંદોલન ચલાવીશું અને એમાં ભાજપને નુક્શાન થઈ શકે છે.

## સુરતમાં આરટીઈની 37 हजर अरञ्जनी તપાસમાં 8 હજાર રદ

**ાવગુજરાત સમય >** સુરત

**≖**સરતમાં આરટીઈઅરજીના તપાસના પહેલાં જ તબક્કે 37 હજાર અરજીમાંથી બે હજાર અરજી રિજેક્ટ કરાઈ છે, જ્યારે આઠ હજાર જેટલી અરજી અધૂરા પુરાવાને કારણે રદ્દ કરાઈ છે.

સુરતશહેરની 975 જેટલી શાળાઓની 12 હજાર બેઠકો સામે 37 હજાર 123 વાલીઓએ પોતાનાં બાળકને પ્રથમ ધોરણમં પ્રવેશ મળી રહે તે માટે ફોર્મ ભર્યા હતા. જેમાંથી 27132 ફોર્મ માન્ય ઠર્યા છે. સુરત ડી.ઇ.ઓ દ્વારા અધુરા, અપુરતા અને ખોટા પુરાવાઓ રજુ કરીને ફોર્મ ભર્યા હોય તેવા 2085 વાલીઓની અરજી રિજકેટ કરવામાં આવી છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા અંતર્ગત 7906 ફોર્મ રિજેક્ટ થયા છે. આ રિજેક્ટ થયેલા ફોર્મ પૈકી મોટાભાગે ફોર્મ ભરવામાં ભૂલ થઈ હોવાનું અને કેટલાંક કિસ્સામાં એક જ વાલીઓએ એકથી વધારે વખત ફોર્મ ભર્યા હોવાનું પણ જણાયુ છે. સુરત ડી.ઇ.ઓની ટીમે બે વખત ફોર્મ ભરનાર વાલીઓનાં ફોર્મનું ક્રોસ વેરીફિકેશન કરીને તેમાં પણ જો ખોટા પુરાવા રજુ કરવામાં આવ્યા હશે તો ફોર્મ રિજેક્ટ કરવાનું નક્કી કર્યું છે.

સુરતમાં થયેલી આરટીઈની અરજીની સ્થિતિ જોઈએ તો કુલ 37123 અરજીઓ મળી હતી. આ પૈકી તપાસમાં 2085 અરજીઓ રિજેકટ કરવામાં આવી છે.7906 અરજી કેન્સલ કરવામાં આવી છે. જ્યારે 27132 અરજી માન્ય રહી છે.

## હોસ્પિટાલિટી કંપનીએ દાહોદમાં પણ મેમ્બરના નામે ઠગાઈ કરી

શખ્સે એજન્ટ મારફતે અનેક શહેરોમાં ઠગાઈ કર્યાની રાવ

**નવગુજરાત સમય >** દાહોદ

**ા**વડોદરાની પાર્ક પ્રીવેરા હોસ્પિટાલીટી જણાને કંપનીના મેમ્બર બનાવી રૂપિયા કરાવડાવી કોઈ સગવડ નહીં આપી છેતરપિંડી વિશ્વાસઘાત કર્યો હોવાનો વધુ એક કિસ્સો બહાર આવ્યો હતો.

બહાર પ્રવાસે જાઓ ત્યારે તમોને કરાવડાવ્યા હતા. અમારી કંપની તરફથી રહેવાની તથા જમવાની સગવડ કરી આપવાની લાલચ મારફતે દાહોદના ચાર જણાને તેમની ખાતામાં તે ચારે જણા પાસેથી કુલ મળી કરાવડાવી તેમનો ટોલ ફ્રી નંબર આપ્યા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

વડોદરાની પાર્ક પ્રિવેરા હોસ્પિટાલીટી અમદાવાદના અલી અન્સારી તે બંને એ પોતાના એજન્ટ મારફતે ગત પંચાલે કતવારા પોલીસમાં ફરિયાદ તારીખ 3 -1- 2021 ના રોજ જાલત

» વડોદરા,અમદાવાદના ગામે આવેલ અવંતિકા રિસોર્ટ ખાતે અંકિત પંચાલ, કલ્પેશ સોન્ડાગર, સચિન મુનિયા તથા છાયાબેન ચિંતનભાઈ દાની એમ ચારે જણાને પોતાની કંપનીના મેમ્બર બનાવી અંકિતભાઈ ચંદ્રવદનભાઈ પંચાલ પાસેથી રૂપિયા 3,10,000/-, કલ્પેશભાઈ ધીરજલાલ પ્રાઇવેટ કંપની લિમિટેડના માલિકે સોન્ડાગર પાસેથી રૂપિયા2,40,000/-પોતાના એજન્ટ દ્વારા દાહોદના ચાર . સચિન કમાર શશીકાંતભાઈ મુનિયા પાસે થી રૂપિયા3,15,000/-, તેમજ 10.30 લાખ કંપનીના ખાતામાં જમા છાયાબેન ચિંતનભાઈ દાની પાસેથી રૂપિયા1,65,000/-1 અલગ અલગ રીતે પાર્ક પ્રીવેરા હોસ્પિટાલીટી પ્રાઇવેટ લિમિટેડ કંપની ના ખાતામાં જમા

ત્યારબાદ ઉપરોક્ત ચારેય જણાને ટોલ ક્રી નંબર આપવામાં આવ્યો હતો. આપી વડોદરા તથા અમદાવાદના બે પ્રવાસમાં રહેવા જમવાની સગવડ કંપની ભેજાબાજ ઠગોએ પોતાના એજન્ટ દ્વારા કરી આપવામાં આવશે. જ્યારે તેઓ પ્રવાસે ગયા અને રહેવા તથા કંપનીના મેમ્બર બનાવી કંપનીના જમવાની સગવડ માટે તેઓએ એજન્ટ દ્વારા આપવામાં આવેલ ટોલ ફ્રી નંબર રૂપિયા 10.30 લાખ જેટલી ૨કમ જમા પર ફોન લગાવ્યો ત્યારે ફોન સ્વીચ ઓફ આવતા તેઓએ તે કંપનીના ડાયરેક્ટર બાદ તે બંને ઠગોએ પોતાના મોબાઈલ અને માલિક રાહુલ ગુપ્તા તેમજ ફોન સ્વીચ ઓફ કરી ઠગાઈ કર્યાનુ અમદાવાદના અલી અન્સારી ના નંબર પર ફોન લગાવતા તે બંનેના પણ ફોન સ્વીચ ઓફ આવતા દાહોદના ઉપરોક્ત પ્રાઇવેટ લિમિટેડ કંપનીના માલિક ચારેય જણાને પોતે ઠગાયા હોવાનો અને ડાયરેક્ટર રાહુલ ગુપ્તા તથા અહેસાસ થતાં તેઓ ચાર પૈકીના દાહોદ વૈકુંઠધામ સોસાયટીમાં રહેતા અંકિત

### **ક**ઠલાલના ભાટેરાના યુવકનો ગળે ફાંસો ખાઈ આપઘાત

કઠલાલ તાલુકાના વાવના મુવાડાથી લીલા બંગલા તરફ જવાના રોડ ઉપર આવેલા એક લીમડાના ઝાડ ઉપર દુપટ્ટો બાંધી ભાટેરાના યુવકે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ જીંદગીનો અંત આશ્યો હતો. આ બનાવ સંદર્ભે કઠલાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસસુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કઠલાલ તાલુકાના ભાટેરા ભાથીજી ગેટ સામે સંજય ઉર્ફે લાલો મંગળભાઇ શનાભાઇ પરમાર રહે છે. તેઓના દિકરા અક્ષય ઉર્ફે અકો સંજયભાઇ પરમાર ઉ.વ.૨૪ નાઓએ કોઇ અગમ્ય કારણોસર સોમવારે સાંજના ૪ વાગે વાવના મુવાડાથી લીલા બંગલા તરફ જવાના રોડ ઉપર આવેલ લીમડાના ઝાડ ઉપર દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જીંદગીનો અંત આશ્યો હતો. આ બનાવની જાણ મૃતક યુવકના પરિવાર જનોને થતાં તેઓ ઘટના સ્થળે દોડી જઇ કઠલાલ પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી. પોલીસે લાશનું ઇન્કવેસ્ટ ભરી લાશને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપી હતી.

આ બનાવ સંદર્ભે સંજય પરમારની ફરિયાદના આધારે કઠલાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

### GOPAL SNACKS LIMITED

(Formerly known as Gopal Snacks Private Limited)

Registered Office: Plot No. G2322, G2323 & G2324, GIDC, Metoda, Tal.: Lodhika, Dist.: Rajkot, Gujarat, India, I Tel No.: +912827297060 I E-mail: cs@gopalsnacks.com Web: www.gopalnamkeen.com | CIN: U15400GJ2009PLC058781



EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND NINE MONTHS ENDED ON 31"DECEMBER 2023

						(Rs. in milli	ons except EF
		Quarter Ended		Nine Months Ended		Year Ende	
Sr. No.	Particular	31 Dec. 2023	30 Sep. 2023	31 Dec. 2022	31 Dec. 2023	31 Dec. 2022	31 March 2023
		Unaudited	Unaudited	Unaudited	Unaudited	Unaudited	Audited
01	Total Income from Operations	3675.79	3576.91	3633.22	10437.74	10626.23	13946.
02	Net Profit / (Loss) for the period (Before Tax, Exceptional and/or Extra-ordinary items)	265.48	362.19	477.14	1015.28	1187.53	1518.4
03	Net Profit / (Loss) for The Period Before Tax (after exceptional and/ or extra-ordinary items)	265.48	362.19	477.14	1015.28	1187.53	1518.4
04	Net Profit / (Loss) for The Period After Tax (after exceptional and/ or extra-ordinary items)	178.92	272.07	330.95	734.58	851.29	1123.0
05	Total Comprehensive income for the period [comprising profit/(loss) for the period (after tax) and other comprehensive income (after tax)]	178.37	270.77	321.06	730.56	847.03	1132.
06	Paid up equity share capital (face value of ₹1/- per share)	124.60	124.60	124.60	124.60	124.60	124.6
07	Other equity (excluding revaluation reserve)						2,784.
80	Earning per share (of ₹ 1/- each) (not annualized)						
	A. Basic (Rs.)	1.44	2.18	2.66	5.90	6.83	9.0
	B. Diluted (Rs.)	1.44	2.18	2.66	5.90	6.83	9.0

Notes: 1. The above is an extract of the detailed format of Unaudited Financial Results filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing Obligation and Other Disclosures Requirements) Regulations, 2015. The full format of the Unaudited Standalone Financial Results is available on the stock exchange website (www.bseindia.com and www.nseindia.com) and Company's website (www.gopalnamkeen.com)

2.The aforesaid Unaudited Financial Results for the quarter and nine months were reviewed by the Audit Committee and approved by the Board of Directors of the company at their meeting held on April 02, 2024.

Date: April 02, 2024

For, GOPAL SNACKS LIMITED Bipinbhai Vithalbhai Hadvani Chairman and Managing Director

# સરદાર પટેલ યુનિવર્સિટીની પરીક્ષામાં વધુ 6 કોપી કેસ નોંધાયા

**નવગુજરાત સમય >** આણંદ

**ા**સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા લેવામાં દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી આવી રહેલી યુજીની પરીક્ષામાં ચોથા છે. પરીક્ષાના પ્રથમ દિવસે ત્રણ અને બીજા દિવસે વધુ ૬ કોપી કેસ નોંધાયા છે, જેમાં દિવસે દસ અને ત્રીજા દિવસે બે મળીને કુલ અત્યારસુધીમાં કુલ ૨૧ કોપી કેસ નોંધાયા પંદર કોપી કેસ નોંધાયા હતા. ચોથા દિવસે છે. જેમાં સૌથી વધુ બીએ ચોથા સેમેસ્ટરમાં બી.કોમ ચોથા સેમેસ્ટરના બે, બીએ ચોથા

૭ કોપી કેસ નોંધાયા છે. યુનિવર્સિટીની યુજીના અભ્યાસક્રમોની કુલ છ વિદ્યાર્થીઓ કોપી કરતાં ઝડપાયા પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં પરીક્ષા હતા. આમ યુનિવર્સિટીની પરીક્ષામાં ચાર

અને વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે યુનિવર્સિટી તંત્ર સેમેસ્ટરના એક, બીએ છકા સેમેસ્ટરના એક પરીક્ષા વિભાગના જણાવ્યા અનુસાર અને એલએલબી છકા સેમેસ્ટરના બે મળીને દરમ્યાન કોઇપણ પ્રકારની ગેરરીતિ ના થાય દિવસમાં કુલ ૨૧ કોપી કેસ નોંધાય છે

### જાહેર નોટીસ

નોંધાવતા કાર્યવાહી કરાઈ હતી.

ાં કરતાંકદા કહતાંત ના તાંચુકા માન સીમના સર્વે નંબર. ૮૩-૨/ પૈકી ૧, ખાતા નંબર- ૨૬૭૫ ની ૨૦૦૦ યોરસમીટર ની ખુલ્લી તો તે અંગેની જાણ આ નોટીસ પ્રસિદ્ધ થયેથી જમીન જે વસંતભાઇ ભાઇલાલભાઇ ઉર્ફે દિન-૧૦ (દસ) મા દસ્તાવેજી પુરાવા સહીત ભીમજીભાઇ પટેલ એ પોતાની માલીકી કબજા લેખીતમા અમોને નીચે દર્શાવેલ સરનામે અચૂક ભોગવટાની તથા તમામ પ્રકારના બોજાઓથી જાણ કરવી, જો તેમ કરવામાં નહી આવેતો સદર સંપૂર્ણપણે મુક્ત હોવાનું જણાવેલ છે. તેમજ તે મિલકત કે તેના કોઈપણ ભાગ પરત્વે અન્ય જણાવી સદર મિલકત અંગે ટાઇટલ ક્લીચરન્સ કોઈનો કોઈપણ લાગભાગ, હક્ક, હિસ્સો બોજો સર્ટીફીકેટ ની માંગણી કરેલ છે. તેઓને સદરહુ આવેલ નથી અને આવેલ હોય તો તે તમામ સરાકાકટ ના માગણા કરલ છે. તળાળ વેદલ્હું આવલ નથા અને આવલ હોય તો ત તમાન મિલકત અંગેની માલિકી તો. ૨૩-૦૩-૨૦૨૩ ના રોજ (૧) શાંતાબેન ભાઇલાલભાઇ ઉર્ફે બીમજીભાઇ પટેલ ની પત્ની, (૨) દમચંતીબેન બાઇલાલભાઇ ઉર્ફે બીમજીભાઇ પટેલ ની દિકરી તારબાદ કોઇની કોઇપણ પ્રકારની દાદ-ફરિયાદ-તકરાર ચાલશે નહીં તે બાબતની જાહેર જનતા તે રતિવાલ ની પત્ની, (૩) મહેશભાઇ ને તથા લાગતા વળગતા તમામે નોંધ લેવી. ભાઇલાલભાઇ ઉર્ફે ભીમજીભાઇ પટેલ અને (૪) નચનાબેન ભાઇલાલભાઇ ઉર્ફે ભીમજીભાઇ પટેલ સ્થળઃ અમદાવાદ, તારીખ 3 એપ્રિલ, ૨૦૨૪ ની દિકરી તે ભાઇલાલભાઈ ની પત્ની દ્વારા એડવોકેટ અંશ કરવામાં આવેલ રજીસ્ટર્ડ ફારગતી (હક્ક કમી) (8200995649) 101, આગમન દસ્તાવેજ નં. ૧૦૭૪ દ્વારા પ્રાપ્ત થયેલ છે. કોમલેક્સ, મીઠાખળી અન્ડરબ્રિજ, મીઠાખળી

કોઇપણ જાતનો બોજો, લાગ-ભાગ, હક્ક-

हिस्सो तथा डोर्धपए। नाए।।डीय संस्था, जेंड, કોર્પોરેશન, કંપની, પેઢી કે સંસ્થા કે કોઈ પણ જત કિસ્ટ્રીક્ટઃ ખેડા અને રજી્સ્ટ્રેશન સબ-ુ રાખ્સનો કોઇપણ પ્રકારનો ગીરો, લીચન, ચાર્જ કિસ્ટ્રીકટઃ કઠલાલ નાં તાલુકા મોજે કઠલાલ ની હોય કે લાયસન્સ , કબ્જા ભોગવટો/ બનાખત/

સબબ કે સદર જમીન અંગેના દસ્તાવેજ અંગે 6 રોડ , મીઠાખળી . અમદાવાદ

